

- 1) ઉત્પાદન એટલે કુદરતમાંથી મળતી વસ્તુનું એકીતરૂપી રૂપાંતરણ જેથી માનવ જરૂરિયાત માટે ઉપયોગી થાય.
- 2) વૃદ્ધિશીલનું સર્જન અને કિંમતમાં વધારો.
- 3) વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ અને વિશિષ્ટીકરણ.
- 4) ઉત્પાદનને એકાજ અને ઉત્પાદનમિશ્રણ.
- 5) ઉત્પાદનકાર્ય વધુ રીતે કરી છે કે ઉત્પાદન શ્રેષ્ઠ પદ્ધતિથી અને એકામાં એકા ખર્ચ વધા એકામાં એકા સમયમાં થાય. આ માટે ઉત્પાદન સ્થાપના અને અંકુશ સ્થાપના છે. ઉત્પાદન શ્રેષ્ઠ રીતે અને એકે ખર્ચ કરવું તેનું સ્થાપના એટલે ઉત્પાદન અંકુશ.
- 6) સમયસમમાલની ડિલિવરી અને ઉત્પાદનમાં સાલવ.
- 7) ખરીદી એટલે ઉત્પાદન એકમમાં માધનો, જતન અને કામગીરી માટે કરતી માલમામૂલી, યંત્રો અને સેવાઓ મેળવી.
- 8) સદાચમક ખરીદી એટલે નીચા ભાવે માલ ખરીદી કરી ઉંચા ભાવે વેચવી.
- 9) બેલેન્સિટ ખરીદી એટલે અનેક પ્રકારની ચીજવસ્તુઓ એક જ ભાવમાં જતી રહે.
- 10) 1) લેનાની માલમામૂલી નું પ્રમાણીકરણ. 2) ઇંદાનું રહસ્ય જાણવા.
- 11) 1) ખરીદકાર્ય ઉપર સંમાલનનો સીધો અંકુશ રહેતો નથી. 2) સંશલિત જવાનો અંકુશ મુરજો.
- 12) પડતરમાં ઘટાડો અને ગાળાંનો શ્રેષ્ઠ ઉપયોગ.
- 13) કુપો માલની પ્રતિ અને શાલકોને તૈયાર માલ પહોંચાડવા ના વ્યયેના માલને 'માલમામૂલી' કહે છે.
- 14) જે માલમામૂલી મામામૂલીની વધારાની ખરીદવામાં આવે છે, જેના પર કારખાનામાં કોઈપણ પ્રકારે ઉત્પાદનકાર્ય કરવાનું હોય અને જે વસ્તુનો એક ભાગ બને તે કાપોમાલ ગણાય.
- 15) એજેન્સી કે હિસાબરો એટલે ઇન્ડોના એજેન્સી જેનાની માલમામૂલી તૈયાર થાય.
- 16) માલનું ઉત્પાદન અટકવું નહિ પડે તે માટે એજેન્સી છે કે કોઈ પણ વસ્તુનો અમુક જથ્થો સ્ટોકમાં રહે એટલે વરદી સમાવી.
- 17) A B એ માલમામૂલી પર અંકુશ, કુદરતી બળાવવાની સ્થાનિક રૂપા છે.
- 18) સ્થાનિક અંકુશમાં વધારા છૂટા ઉદ્યોગોના અંકુશ માટે વેટ પદ્ધતિનો ઉપયોગ નરવામાં આવે છે.
- 19) નવીન વસ્તુ એટલે કે જે વસ્તુ કનિયાની દ્રષ્ટિએ નવીન છે અને જેનાની ગવું જ બજાર હિલું થાય છે.
- 20) નવી વસ્તુથી અને યથાત પેદારોનો સુધારો.
- 21) વસ્તુની કામગીરીની સંમાલકોને સંગ્રહ થાય એટલે બજાર સંકલન કરતી છે.
- 22) કાન જે બેચી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ છે તેના સમુદાયને પેદાશમિશ્ર કહે છે.
- 23) નફાક્ષરતા અને યંત્રોની શક્તિ.
- 24) વસ્તુનું વિવિધીકરણ એટલે નવી વસ્તુ દ્વારા અથવા જૂની વસ્તુના નવા મોડલ દ્વારા વસ્તુ-ઉત્પાદનનું વિસ્તૃતીકરણ.
- 25) સરલીકરણ એ વિવિધીકરણની વિરુદ્ધ પ્રકાર છે તે માલની વધુ પડતી વિવિધતા અને બિનલોકપિય વસ્તુનું ઉત્પાદન વંદ કરી માલુ વસ્તુઓમાં ઘટાડો નરવારી પ્રકાર છે.